

Chartered Capital And Investment Limited

Regd. Office: 711, Mahakant, Opp. V.S. Hospital, Ellisbridge, Ahmedabad-380 006. Tel.: 079 - 2657 5337 / 2657 7571 / 2657 8029 Fax: 079 - 2657 5731, E-mail: info@charteredcapital.net, Website: www.charteredcapital.net, CIN: L45201GJ1986PLC008577.

CCIL/SE/2023 September 5, 2023

Through BSE listing centre online portal

To, The Secretary **BSE Limited** Dalal Street P J Tower, Fort, Mumbai-400001

Dear Sir,

Ref: Company Code No.511696

Sub: Publication of Newspaper Advertisement regarding Notice of 37th AGM,

e-voting and Book Closure details

In terms of regulation 47 of SEBI (LODR) Regulations, 2015, please find enclosed herewith copies of the newspaper advertisements published in Financial Express (English) and Financial Express (Gujarati) newspapers in September 5, 2023 editions regarding Notice of 37th Annual General Meeting, information relating to evoting and Book Closure of the Company.

Kindly take the same on your record.

Thanking You,

Yours Sincerely
For Chartered Capital and Investment Limited

Manoj Kumar Ramrakhyani Company Secretary

Encl: As above

FINANCIAL EXPRESS

(CIN No.: L29120GJ2013PLG074281) Plot No. 16. Phase 1/2, GIDC Estate, Naroda, Ahmedabad-382330, Guiarat, India Website: www.latteysindustries.com

LATTEYS

Non Stop Watering

NOTICE OF 10TH ANNUAL GENERAL MEETING, **BOOK CLOSURE AND E-VOTING INFORMATION** Notice is hereby given that the 10th Annual General Meeting (AGM) of the company is scheduled to be held on Saturday, September 30, 2023 at 11:00 A.M. (IST) at Registered Office of the Company at Plot No. 16, Phase 1/2, GIDC Estate, Naroda, Ahmedabad - 382330, Gujarat, India in accordance with the provisions of Companies Act, 2013 and rules framed thereunder and SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 to transact

the business as set out in the Notice of AGM. In terms of SEBI & MCA circulars grating relaxation in respect of sending physical copies of Annual Report to Members, the Notice of AGM and Annual Report of the company for the financial year 2022-23 have been sent to through electronic mode to those Members whose e-mail address is registered with the Company / Registrar and Transfer Agent / Depository Participants / Depositories. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the website of the company at www.latteysindustries.com and website of National Stock Exchange limited

(NSE) at https://www.nseindia.com. Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Regulation 42 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Saturday, 23th September 2023 to Saturday, 30th September 2023 (both days inclusive) for the purpose of AGM.

In compliance with the provisions of Section 108 of the Act, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the SEBI Listing Regulations, the Members are provided with the facility to cast their vote electronically, through the e-voting services provided by National Depository Services (India) Limited on all the resolutions set forth in this Notice. The voting rights of Members shall be in proportion to their shares in the paid-up equity share capital of the company as on the cut-off date i.e., Monday, 18th September, 2023

The remote e-voting period commences on Wednesday, 27th September, 2023 at 9.00 A.M. (IST) and ends on Friday, 29th September, 2023 at 5.00 P.M (IST) During this period, members may cast their vote electronically. The e-voting module shall not be allowed beyond this time. Those members who had not casted their votes through remote e-voting and are otherwise not barred from doing so, they shall be eligible to vote through ballot paper during AGM. The members may participate in the meeting even after exercising their right to vote through remote E-voting but shall not be entitled to vote again during the meeting. Detailed instructions for remote e-voting facility are forming the part of the Notice of AGM.

Any person, who acquires the shares as on cut off dates, may obtain login id password by sending a request at helpdesk.evoting@nsdlindia.com. However, if such a person is already registered with NSDL for e-voting, then the existing user ID and password can be used for casting their vote. In case of any grievances connected with facility for voting by electronic means, please contact Mrs Sonika Jain, Company Secretary at email id cs@latteysindustries.com or Number +91 9610042225. For details relating to remote e-voting, e-voting during AGM, members holding shares in physical mode, demat mode and for those members whose email -id is not registered, please refer to the Notice of AGM. In case of any queries relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and evoting user manual available at www.evoting.nsdl.com or write an email evoting@nsdl.co.in or contact at toll free no. 1800 22 55 33.

Sonika Jain Company Secretary

FOR LATTEYS INDUSTRIES LIMITED

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] Sale Notice for sale of Immovable Property

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Property mortgaged to Assets Care & Reconstruction Enterprise Ltd. [CIN: U65993DL2002PLC115769] ("Secured Creditor"), the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 25.09.2023 from 02.00 P.M. to 04.00 P.M., for recovery of Rs. 41,95,039/- (Rupees Forty One Lakh Ninety Five Thousand Thirty Nine only) pending towards Loan Account No. M021XII [Old Loan Account No. HHLLOW00238518], by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 18.08.2023 with applicable future nterest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. 19.08.2023 along with legal expenses and other charges due to the Secured Creditor from MARUTI KRISHNA SHENDE, GEETA MARUTI SHENDE and S.K. ENTERPRISES (THROUGH ITS PARTNERS).

The old Loan Account along with its underlying security(ies), including the Immovable Property, had been assigned by Indiabulls Housing Finance Limited ("IHFL") to Indiabulls Asset Reconstruction Co. Ltd. ("IARCL") vide Assignment Agreement dated 31.12.2019. The said Loan Account has been further assigned by IARCL to and in favour of the Secured Creditor, acting as a Trustee of ACRE-102-Trust vide Assignment Agreement dated 26.04.2021 read with Rectification Deed dated 26.08.2021.

The Reserve Price for the Immovable Property will be Rs. 18,00,000/- (Rupees Eighteen Lakh only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 1,80,000/-(Rupees One Lakh Eighty Thousand only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

THE RESIDENTIAL PREMISES BEARING FLAT NO. - 101, ADMEASURING BUILT UP AREA OF 81.92 SQ. MTR. ON 1ST FLOOR IN EAST DIRECTION IN TOWER - K1 OF THE PROJECT NAMED DOVE - DECK CONSTRUCTED ON 11033.07 SQ. MTRS. OF LAND OF PLOT NO. 3 BEARING REVENUE SURVEY NO. 11/PAIKI 2 OF VILLAGE SAYAJIPURA NEAR PIONEER MEDICAL CAMPUS, OPP. AMERICAN SCHOOL OF BARODA, VADODARA - 300019, GUJARAT, THE SAID FLAT/ UNIT IS SOLD ALONGWITH PROPORTIONATE SHARE OF 31.47 SQ. MTRS. IN THE COMMON PLOT, COMMON ROAD AND ALL OTHER COMMON AND UNDIVIDED LAND IN THE SAID SCHEME. THE SAID FLAT IS BOUNDED AS

UNDER: EAST : SOCIETY INTERNAL ROAD NORTH: TOWER K2

SOUTH: FLAT NO. K1-102 For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.acreindia.in; For bidding, log on to www.auctionfocus.in

AUTHORIZED OFFICER ASSETS CARE & RECONSTRUCTION ENTERPRISE LTD. Date: 31.08.2023 TRUSTEE OF ACRE-102-TRUST

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)]

Sale Notice for sale of Immovable Property

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002. read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement)

Guarantor(s) that the below described Immovable Property mortgaged to Assets Care & Reconstruction Enterprise Ltd. [CIN: U65993DL2002PLC115769] ("Secured Creditor"), the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 25.09.2023 from 02.00 P.M. to 04.00 P.M., for recovery of Rs. 39,00,770/- (Rupees Thirty Nine Lakh Seven Hundred Seventy only) pending towards Loan Account No. R030XII [Old Loan Account No. HHLKAL00285650], by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 18.08.2023 with applicable future interest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. 19.08.2023 along with legal expenses and other charges due to the Secured Creditor from RAKESH DUDWADKAR @ RAKESH LILADHAR DUDWADKAR and KANCHAN SATISH AMBULKAR @ MEERA RAKESH DUDWADKAR.

The old Loan Account along with its underlying security(ies), including the Immovable Property, had been assigned by Indiabulls Housing Finance Limited ("IHFL") to

The Reserve Price for the Immovable Property will be Rs. 24,00,000/- (Rupees Twenty Four Lakh only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 2,40,000/- (Rupees Two Lakh Forty only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

PLOT 4/B OF "DOVE DECK" ON LANDS BEARING REVENUE SURVEY NOS. 11 / PAIKI 1 AND 11 / PAIKI 2 ALONG WITH PROPORTIONATE SHARE OF 40.09. SQ. AND DISTRICT VADODARA IN THE REGISTRATION DISTRICT AND SUB-DISTRICT VADODARA IN THE STATE OF GUJARAT. THE SAID FLAT / UNIT IS

ON THE EAST : OPEN SPACE ON THE SOUTH : FLAT NO. J-502 ON THE WEST : FLAT NO. J-504 ON THE NORTH : CLUB HOUSE For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.acreindia.in; For bidding, log on to www.auctionfocus.in

AUTHORIZED OFFICER Date: 31.08.2023 ASSETS CARE & RECONSTRUCTION ENTERPRISE LTD. Place: VADODARA TRUSTEE OF ACRE-102-TRUST

Rs. 1,82,00,000/-

Rs.

1,82,000/-

1,27,500/-

95,000/-

Rs.

82,000/-

77,180/-

68,340/-

1,15,000/-

Rs.

,28,000/-

,43,000/-

1,39,000/-

Rs. 1,15,00,000/-

Rs. 12,80,000/-

Rs. 1,43,00,000/-

Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and

Indiabulls Asset Reconstruction Co. Ltd. ("IARCL") vide Assignment Agreement dated 31.12.2019. The said Loan Account has been further assigned by IARCL to and in favour of the Secured Creditor, acting as a Trustee of ACRE-102-Trust vide Assignment Agreement dated 26.04.2021 read with Rectification Deed dated 26.08.2021.

FLAT / UNIT NO. J - 503 ADMEASURING 100.24 SQ. MTRS. BUILT UP AREA SITUATED ON 5TH FLOOR IN NORTH-EAST DIRECTION IN "J" TOWER ON MTRS. IN THE COMMON PLOT, COMMON ROAD AND OTHER COMMON AND UNDIVIDED LAND OF THE SAID SCHEME IN VILLAGE SAYAJIPURA, TALUKA

BOUNDED BY AS UNDER:

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] Sale Notice for sale of Immovable Property

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. read with proviso to Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement)

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Property mortgaged to Assets Care & Reconstruction Enterprise Ltd. [CIN: U65993DL2002PLC115769] ("Secured Creditor"), the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 25.09.2023 from 02.00 P.M. to 04.00 P.M., for recovery of Rs. 36,14,524/- (Rupees Thirty Six Lakh Fourteen Thousand Five Hundred Twenty Four only) pending towards Loan Account No. M005XII [Old Loan Account No. HHLVRA00226606], by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 18.08.2023 with applicable future nterest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. 19.08.2023 along with legal expenses and other charges due to the Secured Creditor from MAHESH DASHARATH BOBADI, BHAVANA MAHESH BOBADI, and PETRO REFINING TECHNOLOGIES (THROUGH PARTNERS).

The old Loan Account along with its underlying security(ies), including the Immovable Property, had been assigned by Indiabulls Housing Finance Limited ("IHFL") to Indiabulls Asset Reconstruction Co. Ltd. ("IARCL") vide Assignment Agreemer dated 31.12.2019. The said Loan Account has been further assigned by IARCL to and in favour of the Secured Creditor, acting as a Trustee of ACRE-102-Trust vide Assignment Agreement dated 26.04.2021 read with Rectification Deed dated 26.08.2021.

The Reserve Price for the Immovable Property will be Rs. 24,00,000/- (Rupees Twenty Four Lakh only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 2,40,000/- (Rupees Two Lakh Forty Thousand only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

ALL THAT PART AND PARCEL OF FLAT / UNIT NO. M - 1204 ADMEASURING 109.11 SQUARE METERS BUILT - UP AREA SITUATED ON 12TH FLOOR IN WEST DIRECTION IN "M" TOWER OF "DOVE DECK" RESIDENTIAL SCHEME WHICH HAS BEEN ORGANIZED AND CONSTRUCTED ON 11033.07 SQUARE METERS (118760 SQUARE FEET) OF LAND OF PLOT NO. 3 BEARING REVENUE SURVEY NO. 11 / PAIKI 2 OF VILLAGE SAYAJIPURA, TALUKA AND DISTRICT VADODARA IN THE REGISTRATION DISTRICT AND SUB - DISTRICT VADODARA IN THE STATE OF GUJARAT. THE SAID FLAT / UNIT IS SOLD ALONGWITH PROPORTIONATE SHARE OF 41.97 SQUARE METERS IN THE COMMON PLOT, COMMON ROAD AND ALL OTHER COMMON AND UNDIVIDED LAND OF THE SAID SCHEME. THE LAY-OUT PLAN OF THE SAID SCHEME HAS BEEN APPROVED AS PER 2.5 FSI VIDE DEVELOPMENT PERMISSION NO. UDA/PLAN - 2/359/2013 DATED 27-11-2013. THE SAID FLAT / UNIT IS BOUNDED

AS UNDER:-ON THE EAST : SOCIETY INTERNAL ROAD ON THE WEST : FLAT NO. M - 1203 ON THE SOUTH : COMMON SPACE

ON THE NORTH : FLAT NO. M - 1201 For detailed terms and conditions of the sale, please refer to the link provided on the website of the Secured Creditor i.e. www.acreindia.in; For bidding, log on

AUTHORIZED OFFICER Date: 31.08.2023 ASSETS CARE & RECONSTRUCTION ENTERPRISE LTD. TRUSTEE OF ACRE-102-TRUST Place: VADODARA

यूनियन बैंक 🕼 Union Bank 🕮 कर्चरेशन

Date: 02.09.2023

Place: Ahmedabad

Stressed Asset Management Branch: First Floor, Rangoli Complex. Opp. VS Hospital, Ellisbridge,

SALE NOTICE - E-AUCTION RULE 8(6) & 9(1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002]

WHEREAS you, the under named, have availed credit facilities from Union Bank of India and have defaulted to pay and is due to the Bank for the amount mentioned hereunder, plus further interest, costs and charges. Therefore, Union Bank of India in exercise of the powers conferred u/s 13 of The Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 54 of 2002 has decided to sell the property detailed below in public auction to be conducted by way of e-auction through the website/portal detailed

Rs. 1,66,00,000/-

Rs. 16,60,000/-

Rs. 1,73,00,000/-

Rs. 17,30,000/-

Rs. 1,36,00,000/-

Rs. 13,60,000/-

Rs. 1,93,00,000/-

Rs. 19,30,000/-

Rs.

1,66,000/-

Rs.

1,73,000/-

Rs.

1,36,000/-

Rs.

1,93,000/-

subsequently sold.

Place: VADODARA

Ι.	nereunder.					
	Name of Borrowers/ Guarantors/ Mortgagors	Date of Demand notice u/s 13(2)	Date of Possession u/s 13(4)	Amount mentioned in Demand Notice	Authorised Officer	
	(1). SRK Group, (2). Mr. Nareshkumar Vallabhbhai Pagdhal, (3). Mr. Bhaveshbhai Dhirubhai Pagdhal, (4). Mr. Harsukhbhai Vallabhbhai Pagdhal, (5). Mr. Satishkumar Gopalbhai Patel, (6). Mr. Ashokbhai Narsibhai Patel, (7). Mr. Kapilkumar Vitthalbhai Rank, (8). Late Mr. Kamleshbhai Babubhai Bhesaniya through legal heir, (9). Mrs. Amitaben Kamleshbhai Bhesaniya (widow), (10). Mr./Master	01.10.2018	04.03.2020	Rs. 36,21,25,075.70	Amit Kumar Sinha, (AGM	

Amitaben Kamleshbhai Bhesaniya (widow), (10). Mr./Master Shrey Kamleshbhai Bhesaniya, (11). Ms. Juli Kamleshbhai.				(AGM			
Encumbrances known : SA No. 316/2019 (DRT – II, Ahmedabad) & Type of Possession : Symbolic Posses							
Description of Properties		R	leserve Price EMD	Bid Multiples			
LOT 1 – (Total 57 Flats in Building No. A-01) All the part and parcel of the property total 57 Flats, Building No admeasuring built up area 22281.26 Sq. ft. in the complex known as "M PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-Ko GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name Group including the open land and the following Flats in the complex MANSAROVAR PLAZA". (List of such 57 flats of Project is provided in A	/AR Rs. pp SRK Rs	2,25,00,000/- s. 22,50,000/-	Rs. 2,25,000/-				
LOT 2 – (total 45 Flats in Building No. A-02) All the part and parcel of the property 45 Flats, Building No. A-02, total built up area 22281.26 Sq. ft. in the complex known as "MANSARO situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, OHOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S Stof such 45 flats of Project is provided in Annexure-I)	ZA ² Rs.	1,86,00,000/- s. 18,60,000/-	Rs. 1,86,000/-				
LOT 3 – (total 44 Flats in Building No. A-03) All the part and parcel of the property i.e. total 44 Flats of Building No. admeasuring 17200.54 Sq. ft. built up area in the complex known as "MPLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-Kongram Group. (List of such 44 flats of Project is provided in Annexure-I)	/AR Rs.	1,80,00,000/- s. 18,00,000/-	Rs. 1,80,000/-				
LOT 4 – (total 43 Flats in Building No. A-04) All the part and parcel of the property i.e. total 43 Flats of Building No. admeasuring 16812.11 Sq. ft. built up area in the complex known as "MPLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-Kongram (Signal Hotel, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name Group. (List of such 43 flats of Project is provided in Annexure-I)	/AR Rs.	1,77,00,000/- s. 17,70,000/-	Rs. 1,77,000/-				
LOT 5 – (total 32 Flats in Building No. A-05) All the part and parcel of the property i.e. total 32 Flats of Building No. admeasuring 12505.36 Sq. ft. built up area in the complex known as "MPLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-Kogrin Group. (List of such 32 flats of Project is provided in Annexure-I)	/AR Rs.	1,30,56,000/- s. 13,05,600/-	Rs. 1,30,560/-				
LOT 6 – (total 29 Flats in Building No. A-06) All the part and parcel of the property i.e. total 29 Flats of Building No. admeasuring 11320.91 Sq. ft. built up area in the complex known as "MPLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-Kogirina Hotel, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name Group. (List of such 29 flats of Project is provided in Annexure-I)	ANSARO\ ATHOR, O	/AR HS.	1,19,00,000/- s. 11,90,000/-	Rs. 1,19,000/-			
LOT 7 – (total 45 Flats in Building No. A-07) All the part and parcel of the property i.e. total 45 Flats of Building N admeasuring 17583.28 Sq. ft. built up area in the complex known as "M PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-K GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name Group. (List of such 45 flats of Project is provided in Annexure-I)	ANSARO\ ATHOR, O	/AR Rs.	. 1,85,00,000/- s. 18,50,000/-	Rs. 1,85,000/-			
LOT 8 – (total 38 Flats in Building No. A-08) All the part and parcel of the property i.e. total 38 Flats of Building N admeasuring 14854.99 Sq. ft. built up area in the complex known as "M PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-K GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name Group. (List of such 38 flats of Project is provided in Annexure-I)	/AR Rs.	. 1,57,00,000/- s. 15,70,000/-	Rs. 1,57,000/-				
LOT 9 – (total 47 Flats in Building No. A-09) All the part and parcel of the property i.e. total 47 Flats of Building N admeasuring 18364.24 Sq. ft. built up area in the complex known as "M PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-K GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name Group. (List of such 47 flats of Project is provided in Annexure-I)	ANSARO\ ATHOR, O	/AR Rs.	1,94,00,000/- s. 19,40,000/-	Rs. 1,94,000/-			

LOT 15 - (total 30 Flats in Building No. B-26)

LOT 19 - (total 11 Flats in Building No. C-15)

LOT 14 – (total 45 Flats in Building No. B-25)

WEST : FLAT NO. K1-104

PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-Rs. 18,20,000/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 45 flats of Project is provided in Annexure-I) All the part and parcel of the property i.e. total 30 Flats of Building No. B-26, total Rs. 1,27,50,000/admeasuring 11732.27 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-Rs. 12,75,000/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 30 flats of Project is provided in Annexure-I)

All the part and parcel of the property i.e. total 45 Flats of Building No. B-25, total

admeasuring 17589.30 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR

LOT 16 - (total 22 Flats in Building No. B-27) All the part and parcel of the property i.e. total 22 Flats of Building No. B-27, total Rs. 95,00,000/admeasuring 8613.06 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-Rs. 9,50,000/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 22 flats of Project is provided in Annexure-I) LOT 17 - (total 13 Flats in Building No. C-10) All the part and parcel of the property i.e. total 13 Flats of Building No. C-10, total Rs. 82,00,000/admeasuring 78238.53 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-

Rs. 8,20,000/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 13 flats of Project is provided in Annexure-I) LOT 18 - (total 12 Flats in Building No. C-14) All the part and parcel of the property i.e. total 12 Flats of Building No. C-14, total Rs. 77,18,000/admeasuring 7272.66 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-Rs. 7,71,800/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 12 flats of Project is provided in Annexure-I)

All the part and parcel of the property i.e. total 11 Flats of Building No. C-15, total Rs. 68,34,000/admeasuring 6626.42 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-Rs. 6,83,400/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 11 flats of Project is provided in Annexure-I) LOT 20 - (total 18 Flats in Building No. C-16) All the part and parcel of the property i.e. total 18 Flats of Building No. C-16, total

PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-Rs. 11,50,000/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 18 flats of Project is provided in Annexure-I) LOT 21 - (total 20 Flats in Building No. C-17) All the part and parcel of the property i.e. total 20 Flats of Building No. C-17, total admeasuring 12040.73 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR Rs. 1,28,00,000/-PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-

admeasuring 10828.62 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR

GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Group. (List of such 20 flats of Project is provided in Annexure-I) LOT 22 - (total 22 Flats in Building No. C-18) All the part and parcel of the property i.e. total 22 Flats of Building No. C-18, total admeasuring 13333.21 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK

Rs. 14,30,000/-Group. (List of such 22 flats of Project is provided in Annexure-I) LOT 23 - (total 21 Flats in Building No. D-19) All the part and parcel of the property i.e. total 21 Flats of Building No. D-19, total admeasuring 12686.97 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR Rs. 1,39,00,000/-PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Rs. 13,90,000/-Group. (List of such 21 flats of Project is provided in Annexure-I)

LOT 24 - (total 14 Flats in Building No. D-20) All the part and parcel of the property i.e. total 14 Flats of Building No. D-20, total admeasuring 8457.98 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR Rs. 93,12,000/-PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-93,120/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Rs. 9,31,200/-Group. (List of such 14 flats of Project is provided in Annexure-I)

LOT 25 - (total 9 Flats in Building No. D-21) All the part and parcel of the property i.e. total 9 Flats of Building No. D-21, total admeasuring 5414.31 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR Rs. 58,78,000/-Rs. PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-58,780/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Rs. 5,87,800/-Group. (List of such 9 flats of Project is provided in Annexure-I) LOT 26 - (total 20 Flats in Building No. D-22)

All the part and parcel of the property i.e. total 9 Flats of Building No. D-22, total admeasuring 12094.31 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR" Rs. 1,33,00,000/-Rs. PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-1,33,000/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK Rs. 13,30,000/-Group, (List of such 20 flats of Project is provided in Annexure-I) LOT 27 – (total 16 Flats in Building No. D-23) All the part and parcel of the property i.e. total 16 Flats of Building No. D-23, total admeasuring 9750.46 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR | Rs. 1,07,27,000/-Rs. PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-1,07,270/-GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ SURAT in the name of M/S SRK Rs. 10,72,700/-

Group. (List of such 16 flats of Project is provided in Annexure-I)

through online mode on www.mstcecommerce.com. The successful bidder so declared by the Authorised Officer shall deposit 25% of the sale price (inclusive of EMD) in DD/NEFT/Internet transfer subject to realisation, immediately on the sale day or not later than next working day in A/c No. 048921980050000, Union Bank of India, SAMV branch, Ahmedabad, the Branch Code being 904899, IFSC Code UBIN0904899 and the balance 75% of the Sale Price on or before 15" day of confirmation of sale or within such extended period as agreed upon in writing between the secured creditor and the purchaser, in any case not exceeding 3 months. In the event of failure to tender 25% (15% + EMD) of the sale price as per the terms of Sale by the successful bidder, the EMD so deposited by him shall be forfeited to secured creditor and the bid accepted shall stand cancelled automatically and the defaulting bidder shall neither have claim on the property nor on any part of the sum for which it may be subsequently sold. In default of payment of balance amount of purchase price before 15 days from the date of confirmation of sale by the Secured Creditor or such extended period as may be mutually agreed upon between the secured creditor and the purchaser (not exceeding 3 months) the deposit of 25% of the amount of sale price made shall be forfeited and the property shall forthwith be sold again and the defaulting purchaser shall neither have claim on the property nor on any part of the sum for which it may be

The property will be sold by holding public e-auction on 26.09.2023 from 12:00 P.M. to 5:00 P.M. by inviting bids from the public

The interested bidders may inspect the property on 20.09.2023 with prior intimation and permission from the Authorised Officer. A copy of the detailed terms of sale is enclosed for your reference. Date: 04.09.2023, Place: Ahmedabad Authorised Officer, Union Bank of India



to www.auctionfocus.in

Chartered Capital And Investment Limited Regd. Office: 711, Mahakant, Opp V.S. Hospital, Ellisbridge, Ahmedabad - 380 006. CIN: L45201GJ1986PLC008577 | Ph.: 079-2657 5337, Fax: 079-2657 5731

NOTICE OF 37TH ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given pursuant to the provisions of Section 91 of the Companies Act. 2013 & applicable Rules thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ["SEBI (LODR) Regulations"] that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, September 22, 2023 to Thursday, September 28, 2023 (both days inclusive) for the purpose of 37th Annual General Meeting ("AGM") of the company to be held on Thursday, September 28, 2023 at 11:30 a.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM").

In terms of Section 108 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 44 of SEBI (LODR) Regulations, the Company is pleased to offer e-voting facility to all its members to enable them to cast their vote electronically using remote e-voting system as well as e-voting during the AGM, on all proposed resolutions set forth in the Notice. For this purpose, the Company has availed the services of National Securities Depository Limited (NSDL). All the members are informed that:

a) Annual Report for FY 2022-2023 including Notice of 37th AGM has been sent to all the members whose email Id is registered with Company/Depository Participants ("DP") on their email id on September 04, 2023. In terms of Ministry of Corporate Affairs ("MCA") Circular dated December 28, 2022 and SEBI Circular dated January 05, 2023 & other relevant circulars issued by MCA & SEBI, the Annual Report for FY 2022-2023 along with Notice of the AGM has been sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/ DP and holding shares as on the cut-off date for the dispatch. Accordingly, hard copies of the Annual Report will not be sent to any member. Members, whose email id is not registered with the Company/DP, may write to info@charteredcapital.net for obtaining the soft copy of the Annual Report and Notice of AGM.

b) The remote e-voting period will commence on Monday, September 25, 2023 at 9:00 a.m. and will end on Wednesday, September 27, 2023 at 5:00 p.m. The remote e-voting shall not be allowed beyond 5.00 p.m. on September 27, 2023. The facility for e-voting will also be made available during the AGM and the members attending the meeting through VC who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right during the AGM. Detailed instructions including process and manner for e-voting are given in the AGM

c) Annual Report for FY 2022-2023 including Notice of AGM is available on the Company's website www.charteredcapital.net and Notice of the AGM is also available on the NSDL's website www.evoting.nsdl.com.

d) Members are requested to note that a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date (i.e. September 21, 2023) shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM.

 e) Any person who becomes a member of the company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e. September 21, 2023, may cast their votes electronically by following the instructions and process of e-voting as provided in the Notice of the AGM. Members are requested to note that a member may attend & participate in the

AGM even after exercising his right to vote through remote e-voting. However he/she shall not be entitled to cast their vote again. g) In case of any queries or you need any assistance, you may refer the Frequently

Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on.: 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request to Ms. Pallavi Mhatre at evoting@nsdl.co.in. For any sort of query or information including e-voting, the shareholders may also contact Mr. Manoj Kumar Ramrakhyani, Company Secretary at the registered office address of the Company or write an email to info@charteredcapital.net or call him at Tel: 079-2657 5337, 2657 7571.

For, Chartered Capital And Investment Limited Place: Ahmedabad Mohib N Khericha Date: September 4, 2023 Managing Director

SCANPOINT GEOMATICS LIMITED

Regd. Office: D-1002-1021, 10th Floor, Swati Clover Shilaj Circle, S.P. Ring Road, Shilaj Daskroi, Ahmedabad - 380059 CIN: L22219GJ1992PLC017073 Ph.: 079-46023912 | Email: cs@sgligis.com | Website: www.sgligis.com NOTICE TO MEMBERS OF THE COMPANY

ANNUAL GENERAL MEETING ("AGM") OF THE COMPANY

NOTICE is hereby given that the 31st AGM of the Members of the Company will be held on Friday, September 29, 2023 at 12:30 p.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the business as set out in Notice of the AGM which will be circulated through email only to those members whose email addresses are registered with the Company Depositories Participant ("DP") / Registrar and Share Transfer Agent ("RTA"). This is in accordance with applicable provisions of the Companies Act, 2013 and in compliance with General Circular No. 14/2020 dated April 8, 2020, No. 17/2020 dated April 13, 2020, No. 20/2020 dated May 5, 2020, No. 02/2021 dated January 13, 2021 and No. 10/2022 dated December 12, 2022 issued by the Ministry of Corporate Affairs, (MCA Circulars) and circulars No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 and dated No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 issued by Securities

Exchange Board of India (SEBI circulars). The Company is pleased to provide the facility to attend AGM through VC / OAVM, right to vote at the AGM by electronic mode and the business will be transacted through remote e-voting prior to the AGM. The Instructions for joining the AGM through VC / OAVM and the manner of taking part in the e-voting process will be provided along with the Notice and Annual Report.

PROCESS TO REGISTER / UPDATE EMAIL ID / BANK DETAILS WITH THE COMPANY / RTA / DP

The members who have not registered / updated their e-mail id / bank details with the Company / RTA / DP are requested to register / update them with the Company / RTA / DP to receive e-communications / dividend, as and when declared by the Company, directly in their bank account through electronic mode. The members are requested to follow below mentioned steps:

(I) Members holding equity shares in Physical Mode:

Members are requested to provide name, folio no., mobile number, scanned copies of share certificate(s) (both sides), self-attested ID address proof and e-mail id / cancelled cheque through an e-mail at

ahmedabad@linkintime.com or at info@sgligis.com. (ii) Members holding equity shares in Dematerialized Mode:

Place : Ahmedabad

Members are requested to update their e-mail id / Bank details through their depository participants.

NOTICE OF BOOK CLOSURE

NOTICE is hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of Listing Regulations that the register of members and share transfer book of the Company will remain closed from Saturday, September 23, 2023 to Friday, September 29, 2023 (both days inclusive) for the purpose of

This information and further details in this regard along with Annual Report including notice of AGM will also be available on the website of the Company at www.sgligis.com and at website of stock exchange i.e. www.bseindia.com. For Scanpoint Geomatics Limited Date: September 04, 2023

Kantilal Vrajlal Ladani Whole-Time Director (DIN: 00016171)



LOT 10 - (total 40 Flats in Building No. A-11)

LOT 11 - (total 42 Flats in Building No. A-12) A

LOT 12 - (total 33 Flats in Building No. A-13)

LOT 13 - (total 55 Flats in Building No. A-24)

All the part and parcel of the property i.e. total 40 Flats of Building No. A-11, total

admeasuring 15632.93 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR

PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-

GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK

Il the part and parcel of the property i.e. total 42 Flats of Building No. A-12, total

admeasuring 16418.43 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR

PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-

GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK

All the part and parcel of the property i.e. total 33 Flats of Building No. A-13, total

admeasuring 12906.38 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR

PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-

GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK

All the part and parcel of the property i.e. total 55 Flats of Building No. A-24, total

admeasuring 21493.97 Sq. ft. built up area in the complex known as "MANSAROVAR

PLAZA" situated at revenue survey No-683, Block no-550, At & Post-KATHOR, Opp.-

GIRNAR HOTEL, Beside Toll Plaza, NH-8 KHEMRAJ, SURAT in the name of M/S SRK

Group. (List of such 40 flats of Project is provided in Annexure-I)

Group. (List of such 42 flats of Project is provided in Annexure-I)

Group. (List of such 33 flats of Project is provided in Annexure-I)

Group. (List of such 55 flats of Project is provided in Annexure-I)

Regd. N.T. 604 ONE-42 Complex, B/h Ashok Vatika, Nr. Jayantilal Park BRTS, Ambli Bopal Road, Ahmedabad - 380058 Tele, 79-29641996 | 79-29641997 Email: ascsteelad1@gmail.com • Website: www.steelcraft.co.in

NOTICE TO THE SHAREHOLDERS OF 51st ANNUAL GENERAL MEETING OF AHMEDABAD STEEL CRAFT LIMITED

Notice is hereby given that the 51st Annual General Meeting of Ahmedabad Steel Craft Limited will be held on Tuesday, September 26, 2023 at 12:00 Noon IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") (hereinafter referred to as "electronic mode") to transact the business as set out in the Notice of Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 and 110 of Companies Act, 2013 read with Rule 20 and 22 of Companies (Management & Administration) Rules, 2014, as amended and all other applicable provisions of Companies Act, 2013 including any statutory modification or re-enactment thereof for the time being in force and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 18/2020 dated April 18, 2020, General Circular No. 18/2020 dated April 18/ eral Circular No. 39/2020 dated December 31, 2020 and General Circular No. 10/2021 dated June 23, 2021and Secretarial Standard-2 (SS-2), the Postal Ballot notice seeking approval of shareholders by voting through electronic mode ("e-voting/ remote e-voting") has been sent to the members/ beneficiaries whose names appear in the Register of Members / list of Beneficial Owners on the cut-off date, i.e. Friday, August 25, 2023, in respect of the businesses as set forth in the Notice of the 51st AGM

In this regard, the members are hereby notified that:

- A person whose name is recorded in the register of members or in register of beneficial interest owners maintained by the depositories as on Tuesday, September 19, 2023 (cut-off date) shall be entitled to vote on the resolutions proposed to be passed by Postal Ballot / remote e-voting and any person who is not a member as on that date should treat this Postal Ballot notice for information purpose only.
- The Postal Ballot Notice along with the instructions for e-voting has been dispatched by e-mail to the Members on their email addresses registered with the Company / Registrar and Transfer Agents/ NDSL/ CDSL/ Depository Participants), whose names appear in the Register of Members / list of Beneficial Owners as received from NSDL/CDSL. In accordance to the requirements of MCA Circulars, the hard copy of the notice along with the postal ballot form and postage prepaid self-addressed business reply envelope to the members will not be sent to the members for this postal ballot and the members are requested to communicate their assent or dissent through remote e-voting system only.
- For the business as set out in the Postal Ballot Notice, the Company is providing e-voting facility to all the members to enable them to cast their vote electronically. The Company has appointed Link Intime India Private Limited (LIIPL) for facilitating e-voting facility.
- The remote e-voting period commences on Friday, September 22, 2023 at 9.00 A.M. (IST)and ends on Monday, September 25, 2023 at 5.00 P.M. (IST). Remote e-voting shall not be allowed beyond 5.00 P.M. (IST) Monday, September 25, 2023.
- The Company has completed the dispatch of the Notice of Postal Ballot today i.e. on 4th September,
- Share Transfer Books of the Company shall remain closed from Wednesday, 20th September, 2023 to Tuesday, 26th September, 2023 (both days inclusive) for the purpose of the Annual General Meeting.
- The members whose email address are not registered may temporarily register their email address by clicking on the link at https://linkintime.co.in/emailreg/email register.html and follow the registration process as guided thereafter. Post successful registration of such email address, the member would get soft copy of the Notice and the procedure for remote e-voting along with the user ID and password to enable remote e-voting for this postal ballot. In case of any queries, members may write to: enotices@linkintime.co.in.
- The Company has appointed Mr. Amrish Gandhi (Certificate of Practice No. 5656), failing him, Practicing Company Secretaries as the Scrutinizer for conducting the remote e-voting and the voting process at the 51st AGM in a fair and transparent manner and Mr. Amrish Gandhi has given his consent to act as
- Scrutinizer will submit his report to the Chairman of the meeting not later than two (2) days of conclusion of the AGM of the Company. The result with the Scrutinizer's Report will be announced and displayed at the Registered Office. The said result would be available on the website of the Company www.steelcraft.co.in and of Link Intime. The same would be uploaded on the website of BSE in accordance with the LODR.
- The Postal Ballot Notice along with the e-voting instructions are also available on the website of the Company i.e. www.steelcraft.co.in and website of LIIPL i.e. https://instavote.linkintime.co.in and https:// instameet.linkintime.co.in and at the relevant sections of the websites of the stock exchanges on which the shares of the Company are listed i.e. www.bseindia.com
- 11. In case shareholders/ members have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions ('FAQs') and Insta Vote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or send an email to enotices@linkintime.co.in or contact on :- Tel.: 022 - 4918 6000.

For, Ahmedabad Steel Craft Limited Date: 04/09/2023 Siddhi Shah Place: Ahmedabad **Company Secretary & Compliance Officer**

જિગર કેબલ્સ લિમિટેડ રજી. કચેરી : પ્લોટ નં. ૧૬૪/૧૪ અને ૧૫, જામવાઠી, જી.આઇ.ડી.સી., ગોંકલ, રાજકોટ - ૩૬૦૩૧૧, ગુજરાત WIRES & CABLES (MIRA) CIN: L28999GJ2017PLC09565 વેબસાઇટ : www.sigmacab.com, ક્રોન : +91-2825-221422,

૭મી વાર્ષિક સાદ્યારણ સભા, બુક કલોઝર અને ઈ-વોર્ટિઝ માટેની સૂચના અહીં સૂચના આપવામાં આવી કે જિગર કેબલ્સ લિમિટેડની ૭ મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ), શુક્રવારે, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કંપનીની રિજ્સ્ટર્ડ ઓફિસે પ્લોટ નંબર ૧૬૪/૧૪ અને ૧૫, જામવાડી, જી.આઇ.ડી.સી., ગોંકલ, રાજકોટ - ૩૬૦૩૧૧, ગુજરાત (ભારત) ખાતે રાખવામાં આવી છે. જેમાં ઓગસ્ટ ૩૧, ૨૦૨૩ની બોર્ડ મીટીંગમાં મંજૂર કરાચેલ નોટિસમાં નકકી

કર્યા મુજબ દાંદ્યાનો વ્યવહાર કરવામાં આવશે. એજીએમની સૂચના કંપનીના બધા સભ્યોને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ આઇડી ડિપોજિટરિસ સહભાગીઓ (ડીપી) સાથે નોંધાયેલા છે. જે સભ્યોના धंभेछल नोंघायेला नथी, तेमने नोटिसनी नडल तेमना नोंघायेला सरनामे मोडलायेल छे. શેરહોલ્ડરો કે જેમણે અત્થાર સુધી તેમના ઇમેઇલ એડ્રેસ નોંધાવેલા નથી. તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઇમેઇલ એડેસને નોટીસ સાથે જોડાયેલ કોર્મ ભરીને નોંઘણી

કંપનીનો નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો એન્યુઅલ રિપોર્ટ તથા નોટિસ કંપનીની વેબસાઇટ www.sigmacab.com, બોમ્બે સ્ટોક એક્સચેંજની વેબસાઇટ www.bseindia.com અને નેશનલ સિકચોરિટીસ ડિપોજિટરિસ લિમિટેડ (એનએસડીએલ)ની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ રહેશે.

જે સભ્યોના ઇમેલ એડ્રેસ કંપની/ડીપી સાથે નોંધાયેલા છે તેઓને લોગ ઇન ઓળખપત્રો તેમના ઇમેઇલ પર મોકલી આપવામાં આવ્યા છે. જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ નોંધાયેલા नथी अथवा हेमने એन्युअल रिपोर्ट अने नोटिस ना मणेल होय तेवा सल्यो cs@sigmacab.com પર ઇમેલ દ્વારા પોતાના કીપી/કલાઇન્ટ આઇકી, નામ, PAN, મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ આપી નોંધાવી શકશે. જે સભ્યોએ ઇમેલ એડ્રેસ નોંધાવેલ નથી, તેઓ પણ એજીએમની નોટિસમાં દશવિલ ઘંધા માટે પોતાનો મત એજીએમની નોટિસમાં દર્શાવેલ સૂચના મુજબ રિમોટ ઈ-મતદાનથી અથવા એજીએમ દરમિયાન પોતાનો મત આપી શકેશે. સંભામાં હાજર રહેવા માટેની તેમજ મતદાનની પ્રક્રિયાની સૂચનાઓ ૭ મી સાધારણ સભાની નોટિસમાં આપવામાં આવી છે જે ઉપર દર્શવિલ વેબસાઇટ પર પણ અપલોક કરવામાં આવી છે.

કંપની અદ્યિનિયમ, ૨૦૧૩ (એક્ટ)ની કલમ ૯૧ને અનુરૂપ, કંપનીએસ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમ, ૨૦૧૪ અને સેબીના નિયમન ૪૨ (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડીસકલોઝર આવશ્ચકતાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સેબી રેગ્યુલેશન), આગામી એજીએમ હેતુ માટે કંપનીના સભ્યોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ આંગામી શનિવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૩ થી શુક્રવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૩ (બંને દિવસ સહિત) બંઘ રહેશે. સેબી રેગ્યુલેશન ૪૪ સુધારેલા અને નિયમન મુજબ કંપનીસ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમ, ૨૦૧૪ના નિયમ ૨૦ ની સાથે વાંચવામાં આવેલા અધિનિયમની કલમ ૧૦૮ની શરતમાં કંપની તેના સભ્યોને તેમના અધિકારનો ઉપયોગ કરવા સુધિધા આપી રહી છે. એનએસડીએલ દ્વારા પ્રદાન થયેલા ઈ-મતદાન સેવા દ્વારા, કંપનીના એજીએમ (દૂરસ્થ ઈ-મતદાન) બોલાવવાની સૂચનામાં ઉલ્લેખિત કોઇપણ અથવા તમામ વ્યવસાયો પર ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતે આપી શકાશે. અધિનિયમ મુજબની વિગતો નીચે મુજબ છે :

(એ) છેલ્લી તારીખ, એટલે કે શુક્રવાર, સપ્ટેમ્બર રર, ૨૦૨૩ ના રોજ શેર ઘરાવતા સભ્યો (પાત્ર સભ્યો), એજીએમ બોલાવવાની નોટિસમાં ઉલ્લેખિત કોઇ પણ અથવા તમામ દાંદા પર એજીએમ પર યોજનારી દૂરસ્થ ઈ-મતદાન દ્વારા તેમજ એજીએમ દરમિયાન મતદાન કરવાના તેમના અધિકારનો ઉપયોગ કરી શકશે.

(બી) દૂરસ્થ ઇ-અતદાન સોમવાર, સપ્ટેમ્બર ૨૫, ૨૦૨૩ના રોજ સાંવારે ૦૯:૦૦ વાગ્યે શેરૂ થશે અને ગુરૂવાર, સપ્ટેમ્બર ર૮, ર૦૨૩ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે અને દૂરસ્થ ઇ-મતદાન મોક્યુલ ત્યારબાદ મતદાર માટે અસક્ષમ કરવામાં આવશે. તથા ત્યારબાદ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવાની મજૂરી આપવામાં આવશે નહીં. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા પછી, સભ્યને તે પછીથી બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દૂરસ્થ ઇ-વોર્ટિંગ દ્વારા તેના મતના અધિકારનો ઉપયોગ કર્યો પછી પણ પાત્ર સભ્યો એજીએમમાં ભાગ લઈ શકે છે પરંતુ એજીએમમાં ફરીથી મત આપી શકશે નહીં. એજીએમ દરમિયાન ફકત પાત્ર સભ્યો જ મેતદાનની સુવિધા મેળવવા માટે કકદાર રકેશે.

(સી) જો કોઈ વ્યક્તિ એજીએમ નોટિસ મોકલ્યા પછી કંપનીનો સભ્ય બન્યો હોય પરંતુ છેલ્લી તારીખ એટલે કે સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૩ પહેલા, તેઓ CS પ્રિયંકા મારવણીયા (કંપની સચિવ) ને ઇમેલ આઇ ડી cs@sigmacab.com ઉપર દૂરસ્થ ઇ-મતદાન માટેના ઓળખપત્રો મેળવવા માટે ઇમેલ કરી શકે છે.

ઈ-મતદાન ને લગતા તમારા કોઈ પણ પ્રશ્નો અથવા સમસ્યાઓ માટે તમે evoting@nsdl.co.in અથવા cs@sigmacab.com પર ઇમેઇલ લખી શકો છો. વધુમાં જણાવતા, કંપનીના દસ્તાવેજોના નિરીક્ષણ માટે તમે cs@sigmacab.com ઉપર ઇમેલ કરી શકો છો અથવા એજીએમના દિવસે અને કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ બધા કામકાજના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૦૬:૦૦ વાગ્યા સુધીમાં, મીટિંગના સમાપનના દિવસ સુધી ઉપલબ્ધ રહેશે.

તારીખ : સપ્ટેમ્બર ૦૫, ૨૦૨૩ સ્થળ : ગોંકલ (રાજકોટ)

ષ્ટ્રિગર કેબલ્સ લિમિટેક વતી એસડી/-, સંગીતાબેન વઘાસીયા ચેરમેન અને મેનેજિંગ કિરેકટર

Place: Ahmedabad

Date:- 05-09-2023



જાહેર જનતાને જણાવવાનું કે નીચે જણાવેલ ગ્રાહકએ અમારી બેંક માંથી સોનાના દાગીના મૂકી ધિરાણ મેળવેલ પરંતુ સદર ગ્રાહકે ગોલ્ડ લોન ની શરતો નું ભંગ કરેલ હોય અને ધિરાણ ની રકમ બેંક માં ભરતા ના હોય સદર ધિરાણ ના લેણાં ની વસુલાત મોટે નીચે જણાવેલ સોનાના દાગીના ની હરાજી મોટે આ જાહેર નીટીસ આપીએ છીએ. દરાજી ની કાર્યવાહી આઈ.ડી.બી.આઈ. બેંક લિ. ની મંજૂસર શાખા તા. ૧૨./૦૯/2023 ના ગોજ સ્પાર્ટ ૧૧.૦૦ લાગ્રી શ્રી શ્રાહ્માં આઈ.ડી. ર/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ વાગે થી હાથ ધરવામાં આવશે.

ખાતા નં.	કરજદારનું નામ અને સરનામું	ગીરો મૂકેલા સોનાના દાગીનાનું વર્ણન	ગ્રામમાં કુલ વજન	ઈએમડી અને અનામત કિંમત
20986711 00002462	રાધા કિશન કેટરર્સ, ગ્રા. ફલોર દુકાન નં. ૧, કુંજ કોમ્પ્લેસ, મંજૂસર	સાંકળ 1	14.81 ગ્રામ	ઈએમડી Rs – 3300/- અનામત કિંમત Rs 66000/-

દરાજી બેંક દ્વારા નક્કી કરાચેલ દરાજી મોટેના વેચાણના નિયમો અને શરતોને આધિન રહેશે, જેની એક નકલ મંજૂસર શાખાના નોટિસ બોર્ડમાં ૦૪.૦૯.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦ વાગે લગાવવામાં આવશે. બોલી લગાવનાર બેંક દ્વારા નિર્ધારિત નિયમો અને શરતો નું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે તેવું માની દરાજી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીંક જમા કરવાની છેલ્લી તારીખ ૧૧.૦૯.૨૦૨૩, સાંજે ૫.૦૦ કલાક સુધી છે.

સહી/- અધિકૃત અધિકારી, આઈડીબીઆઈ બેંક, મંજૂસર શાખા તારીખ : ૦૪.૦૯.૨૦૨૩ સ્થળ : વકોદરા

वैक ऑफ़ बड़ौदा क्शापा : भे-६, ९०, २त्ना५२ नार्धन स्डवेर, वशापुर **Bank of Baroda** ६-भे६त :VASTRA@bankofbaroda.com

પઝેશન નોટિસ (સ્થાવર મિલકત માટે)

નીચે સહી કરનાર, બેંક ઓફ બરોડાના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરિટાઈઝેશ એન્ડ રિકન્સ્ટ્રફ્શાન ઓફ ફાયનાન્શીયલ એરોટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, २००२ અંતર્ગત અને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) इत्स ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) અંતર્ગત આપવામાં આવેલી સત્તાની ૧७.૦૨.૨૦૨૦ ડિમાન્ડ નોટીસ જારી કરી હતી. જેમાં ઉધારકર્તા શ્રીમતી પ્રેમીલાબેન જનક્કુમાર સોની ને નોટીસમાં દર્શાવેલી ૨કમ રૂા. ૧૪,૧૨,૯७૦/- (રૂા. ચોદ લાખ બાર હજાર નવસો સિત્તેર ફક્ત) નોટિસમાં દર્શાવ્યા પ્રમાણે આગામી વ્યાજ, ખર્ચા, કોસ્ટ, રાર્જીસ / ઓર્છ વસુલાત કરવી પડશે દૃ૦ દિવસોની અંદર નોટીસ મળ્યાની તારીખથી ભરાવ જ્યારેલ હતુ.

ઉદ્યારકર્તા / ગિરવેદાર / જામીનદાર રકમ ચૂકવવમાં નિષ્ફળ જવાથી આથી ઉદ્યારકર્તા જામીનદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અદ્યોહસ્તાક્ષરીએ નીચે દર્શાવલ મિલકતનો તેમને મળેલ સત્તાનો ઉપયોગ કરતા કાયદાની પેટા કલમ (૪) કલમ ૧૩ નિયમ ૮ સાથે વંચાણે લેતા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ, ૨૦૦૨ આ અદિનિયમની ક્લમ ૧૪ હેઠળ ૨૮.૦૧.૨૦૨૨ ના માનનીય સીએમએમ અમદાવાદના આદેશના પ્રતિપાલન રૂપે **તા**. **૦૩.૦૯.૨૦૨૩** ના રોજ **પ્રત્યક્ષ ક્લજો** લીધેલ છે.

ઉદ્યારકર્તા/ગિરવેદાર/જામીનદારોને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહ્ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહ્ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ બરોડા** ની રકમ **રા**. ૧૪,૧૨,૯७૦/- (રૂા. ચોદ લાખ બાર હજાર નવસો સિત્તેર ફક્ત) અન્ય વ્યાજ સાથે નોટિસમ દર્શાવેલ, અન્ય ખર્ચાઓ, કોસ્ટ, લાગુ ચાર્જાસ / રિક્વરી બાદ કરતા ચુકવણીની તારીખ સંધીના બોજાને આધીન રહેશે.

સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાનું મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

શ્રીમતી પ્રેમીલાબેન જનકકુમાર સોનીની માલિકીની મિલકત ફ્લેટ નં. બી/30૬, ક્ષેત્રફળ અંદાજે દૂટ સ્કે. ચાર્ડ્સ એટલે કે પદ્ .દજ સ્કે. મીટર્સ, ત્રીજા માળે, અવિભાજીત ભાગ સાથે બ્લોક બી ની જમીન પર, રેત્ન રાજ રેસીડેન્સી નામે જાણીતી સ્કીમમાં, જમીન સર્વે નં. ૫૮૪/૩, ડ્રાફ્ટ ટીપી સ્ક્રીમ નં. ૧૦૭, ફાઈનલ પ્લોટ નં. ૫૦-૩, ન્યુ મણીનગર, ગામ / મોજે રામોલ (ન્યુ મણીનગર), તાલુકા વટવા, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદની હદ અને સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ – ૧૧ – અસલાલી ખાતે આવેલ સમગ્રે મિલક્ત જેની ચર્તુ:સીમા: પૂર્વે: બ્લોક નં. એ પશ્ચિમે: ફ્લેટ નં. બી/૩૦૩, ઉત્તરે: ફ્લેટ નં. બી/૩૦૫, દક્ષિણે: ફ્લેંટ નં. બી/ઁ૩૦૧ અને સીડી. સહી/- અધિકૃત અધિકારી બેંક ઓફ બરોડા

નારીખ : ૦૩.૦૯.૨૦૨૩, સ્થળ : અમદાવાદ

ફोर्म नं. युआरसी-र

ચેપ્ટર XXI ના પાર્ટ 1 હેઠળ નોંધણી વિશે નોટિસ આપતી જાહેરાત [કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૭૪(બી) અને કંપનીઓ (રજીસ્ટર કરવા માટે અધિકૃત) નિયમો ૨૦૧૪ના નિયમ ૪(૧) ને અનુસરીને]

1) કંપનીઝ અધિનિયમ, ૨૦૧૩ની કલમ ઉદદની પેટા કલમ (૨)ના અનુસંધાનમાં ને અનુસરીને આથી નોટિસ આપવામાં આવે છે કે એક અરજીની દરખાસ્ત રજિસ્ટ્રારને અમદાવાદને કરવામાં આવશે કે **શ્રી પરમેશ્વર રેસ્ટોરન્ટ** પાર્ટનરશીપ ફર્મ, કંપની એકટ ૨૦૧૩ના પ્રકરણ XXI ના ભાગ ૧ હેઠળ શેર્સ દ્વારા મર્યાદિત કંપની તરીકે નોંધણી કરાવી શકે છે.

ર) કંપનીના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.

રેસ્ટોરન્ટસ અને હોટલમાં રહેવા માટે રૂમની સુવિધા પૂરી પાડવા માટે (ઝડપી સેવા રેસ્ટોરન્ટસ સહિત) ખાવાના ઘરો, કિઓસ્ક, ફાસ્ટ ફૂડ આફટલેટ્સ, કાફેટેરિયા, ફૂડ કોર્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિકસાવવા, પ્રમોટ કરવા, સ્થાપીત કરવા, માલિકી મેળવવા, હસ્તગત કરવા, સંચાલિત કરવા અને જાળવવા, ચા અને કોફી હાઉસ, સોડા, કેન્ટીન, કેટરિંગ સેવાઓ અથવા અન્ય સ્ટોર ફોર્મેટ અને તેમાં ઈન્ડિયાના પ્રદેશમાં તમામ પ્રકારની સુવિધાઓ, સગવડો, સગવડતા, નાસ્તો પ્રદાન કરે છે અને અન્ય ફ્રેન્ચાઈઝીઓને માસ્ટર ફ્રેન્ચાઈઝી તરીકે લાયસન્સ આપવા. વિકાસ કરવાનો અધિકાર. ઈન્ડિયાના પ્રદેશમાં ચોકકસ સ્થાનો અથવા પ્રદેશોમાં રેસ્ટોર-ટસ, ખાણી પીણાનીના ઘરો, કિઓસ્ક, ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ, કાફેટેરિયા, ફૂડ કોર્ટ, ચા અને કોફી હાઉસ, સોડા ફાઉન્ટેન્સ, કેટરિંગ સેવાઓ અથવા અન્ય સ્ટોર ફોર્મેટની સ્થાપના, સંચાલન અને જાળવણી.

3) સૂચિત કંપનીના મેમોરન્ડમ અને આર્ટિકલ્સ ઓંફ એસોસિયેશનની નકલ સર્વે નં. ૪૦૭, બસેરા પાર્ટી પ્લોટની બાજુમાં, સરદાર પટેલ રીંગ રોડ, આંબલી, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૫૮ ખાતની ઓફિસમાં તપાસી શકાશે.

૪) આ નોટિસ થી એવી સૂચના આપવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિને અ અરજી સામે વાંધો હોય તો આ નોટિસના પ્રકાશનની તારીખથી એકવીસ દિવસમાં પોતાનો વાંધો લેખિતમાં રજિસ્ટ્રાર, સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (CRC), ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ કોર્પોરેટ અફેર્સે (IICA), પ્લોટ ર્નબર દ, ૭, ૮, સેકટર પ, IMT માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા) પીન કોડ- ૧૨૨૦૫૦ ને જણાવી શકે છે અને જેની નકલ કંપની ની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવાની રહેશે.

તારીખ : ૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૩

અરજદારના નામો

(૧) મોહિલ પટેલ (૨) ચશપાલભાઈ ભાભલુભાઈ ખાચર

૩૭ મી વાર્ષિક સાધારણ સભા, ઈ-વોટિંગ માહિતી અને બુક બંધ રેહવાની નોટિસ

આથી નોટિસ આપવાનામાં આવે છે કે ડંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૯૧ અને સંબંધિત નિયમો અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લીઝર રિક્વાયરમેન્ટ્સ)ટ્રેગ્યુલેશન્સ,૨૦૧૫ સેબી (બેલ ઓ.ડી.આર.) રેગ્યુલેશના ના રેગ્યુલેશન ૪૨ અન્વયે ૩૭ મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)ગુરુવાર તા. ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે વિડોયો કોન્ફફરિનિંગ ("વીસી") અન્ય ઓડીઓ વિઝયુઅલ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજવામાં આવશે તે હેતુસર કંપનીની ૨જીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફરબુક શુક્રવાર તા. ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ગુરુવાર તા. ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ગુરુવાર તા. ૨૦૫૧ ના સ્ટાર્થ સ્

ગુરુવાર તો. રહે માં સપ્ટમ્પર, રેપરક, બિક્ષાદેવસાં સહાતો ખવે રહશે. કંપનીઝ એક્ટર ૨૦૧૩ ની. કંલમ ૧૦૮ અને સંબંધિત નિયમોની જોગવાઈઓ અને સેબી (એલ એી.ડી. ઓર.) રેગ્યુલેશન્સ ના રેગ્યુલેશન ૪૪ સાથે વાંયતા નીટિસમાં જણાવેલ બધા જ પ્રસ્તાવિત 6રાવો પર ઇલેક્ટ્રોનિક ઢબે મત આપી શકે તે માટે રિમોટ ઈ-વોટિંગ તેમજ એજીએમ દરમિયાન ઈ-વોટિંગ સુવિધા તેના બધા સભાસદોને આપતા કંપની હર્ષ અનુભવે છે. આ હેતુ માટે, કંપની એ નેશનલ સિક્યોરિટીઝ કેડીડિઝટરી લિમિટેડ (એનએસડીએલ) ની સેવાઓનો લાભ લીધો હે. શ્રી મળાવ્યુ ને માળી જણાવાણ છે. છે. સૌ સભાસદને આથી જણાવાય છે કે:

5 પના એ નશનલ (સક્યારિટાઝ ડિપાઝિટરા લિમિટેડ (એનએસડીએલ) ની સેવાઓની લાભ લીધો છે. સૌ સભાસદને આથી જણાવાય છે કે:

(A) નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ નો વાર્ષિક અહેવાલ ૩૭મી એજીએમ ની નોટિસ સહીત જે સભ્યોના ઇ-મેઇલ બ્રાઇડી કંપની/ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ્સ (ડી.પી.) સાથે નોધાયેલ છે તેમને ઇ-મેઇલ બ્રાઇડી કંપની/ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ્સ (ડી.પી.) સાથે નોધાયેલ છે તેમને ઇ-મેઇલ બ્રાઇડો કંપની/ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ્સ (ડી.પી.) સાથે નોધાયેલ છે તેમને ઇ-મેઇલ બ્રાઇડો કંપની પરિપત્ર તારીખ ૨૮ ડીસેમ્બર, ૨૦૨૩ અને સંબંધિત પારિપત્રો ની દ્રષ્ટિએ, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ નો વાર્ષિક અહેવાલ એજીએમ નીટિસ ની સાથે જે સભ્યોના ઇ-મેઇલ સરનામાં કંપની/ડી.પી. સાથે નોધાયેલા છે અને કટ-ઑફ તારીએ શેર ધરાવે છે તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જ મોકલવામાં આવ્યા છે. તેથી કોઈ પણ સભ્ય ને વાર્ષિક એહવાલ ની ફિઝિકલ કોપી મોકલવામાં આવી નથી. સભ્યો કે જેની ઇ-મેઇલ આઇડી કંપની / ડી.પી. સાથે ૨જીસ્ટર થયેલ નથી તેઓ info@charteredcapital.net પર વાર્ષિક એહવાલ તથા એજીએમ નીટિસની સફ્ટ કોપી મેળવવા માટે લખી શકો છો. અને બુધવાર ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સાંજના પઃ૦૦ કલાકે પર થશે અને બુધવાર ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ સાંજના પઃ૦૦ કલાક પછી રિમોટ ઇ-વોટિંગ કરવામાં આવશે નહિ. ઇ-વોટિંગ માટે ની સુવિધા એજીએમ દરમિયાન પણ ઉપલબ્ધ કરવામાં આવશે નહિ. ઇ-વોટિંગ માટે ની સુવિધા એજીએમ દરમિયાન પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને વીસી દ્વારા મોટીંગમાં હાજર રહેલા સભ્યો કે જેમણે પેહલા થી રિમોટ ઇ-વોટિંગ દવારા પોતાનો મત આપ્યો નથી, તે એજીએમ દરમિયાન તેમના અધિકાર નો ઉપયોગ કરી સકશે. ઇ-વોટિંગ ની પ્રક્રિયા ની વિગતવાર સુયના અને રીત એજીએમ ની ટિસમાં દર્શાવેલ છે.
(સ) નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ નો વાર્ષિક અહેવાલ એજીએમ ની નોરિસ સહીત કંપનીની વેબસાઈટ www.charteredcapital.net પર ઉપલબ્ધ છે અને એજીએમ ની નોરિસ એનએસડીએલ ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યોને નોધ લવા વિનંતી કે જે વ્યક્તિનું નામ ૨જીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડીપોઝીટરીઝ દ્વારા નારીએ હાલ કંદાર અપો જ રીમોટ ઇ-વોટિંગ અને એજીએમ ની બેર્ય સ્થારા ડીપોઝીટરીઝ ફ્લા હાલ કંદાર અપો કર્યા હાલ કંદાર અપો જ રીમોટ ઇ-વોટિંગ અને એજીએમ ની અથ બન ઇ-વોટિંગ દવારા મતદાન કરવા હકદાર ગણ શે.

કરવા હકદાર ગંલાશ. (ઈ) જે વ્યક્તિ એજીએમ નોટિસ નો રવાનગી પછી કંપનીનો સભ્ય બનશે અને કટ-ઑફ તારીખે એટલે કે ર૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ તારીખે જેમની પાસે શેર હશે તે એજીએમ નોટિસ માં દર્શાવવામાં આવેલ સૂચનો અને રીત પ્રમાણે ઈ-વોટિંગ દ્વારા તેમના મત આપી શકે છે. (એફ) સભ્યોને નોંધ લેવા વિનંતી કે રિમોટ ઈ-વોટિંગ મારફત મત અધિકાર વાર્યા બાદ પણ સભ્ય એજીએમ માં ભાગ લઇ શકશે પણ તેતીણી ફરીથી મત આપવા હકદાર રહેશે નહિ.

(જી) કોઈપણ પ્રશ્નોના કિસ્સા માં, શેરહીલ્ડરો માટે વારંવાર પુછાતા પ્રશ્નો (એફ.એ.ક્યૂ.) નો સંદર્ભ લઇ શકો છો અને ઇ-વોટિંગ વપરાશ કરતા માર્ગદર્શિકા શેરહોલ્ડરો માટે ડાઉનલોડ વિભાગ માં www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે. જે શેર હોલ્ડરો/સભ્યોને એજીએમ પેહલા ના www.evoung.ison.com ૧૮ કેવરાવ્ય – ૪ ૧૮ દર કરા સ્ટિક્ટ્રિય સ્વાય મહાયની જરુર કોય તેઓ ૦૨૨-૪૮૮૬૭૦૦ / ૦૨૨-૪૮૯૭૦૦ પર સંપર્ક કરી શકે છે અથવા વિનંતી મિસ પલ્વવી મહાને ને evoting@nsdi.co.in પર મોકલી શકે છે. કોઈ પણ પ્રકાર ના પ્રશ્નો અથવા માહિતી માટે ઈ-વોટિંગ સહીત શેરહોલ્ડરો શ્રીમાન મનીજકુમાર રામરખ્યાની, કંપની સેક્ટરી ને કંપની ની રજીસ્ટર ઓફિસ ના સરનામે અથવા ઈ-મેઈલ info@charteredcapital.net અથવા ફોન નંબર: ૦૭૯-૨૬૫૭૫૩૩૭

ચાર્ટર્ડ કેપિટલ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ વર્તી તા. સપ્ટેમ્બર ૪, ૨૦૨૩ મેનેજિંગ ડિરેક્ટર

સ્કેનપોઈન્ટ જાઓમેટિક્સ લિમિટેડ

CIN:L22219GJ1992PLC017073 રજી.ઓફિસ: ડી-૧૦૦૨-૧૦૨૧,૧૦મો માળ, સ્વાતી ક્લોવર,શીલજ સર્કલ,એસ.પી.ટીંગ રોડ,શીલજ,દશ્કોઈ,અમદાવાદ-૩૮૦૦૫૮ CIN:L22219GJ1992PLC017073 ફોનઃ ૦૭૯-૪૬૦૨૩૯૧૨ | ઇમેઇલઃ cs@sgligis.com | વેબઃ www.sgligis.com ङंपनीना सભ्योने नोटीस

કંપનીની વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ")

આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૩૧મી વાર્ષિક સામાન્થ સભા ૨૯મી મપ્ટેમ્બર, ૨૦૨૩ ના શુક્રવારે બપોરે ૧૨:૩૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સીંગ ("વીસી") / અન્થ ઓડિયો વિઝચુઅલ મીન્સ ("ઓએવીએમ") દ્વારા યોજાશે. એછુએમ ની નોટીસ એવા સભ્યોન મોક્લવામાં આવશે જે સભ્યો ના ઈમેઈલ આઈડી કંપની / ડિપોઝીટરી પાર્ટીસીપેન્ટ ("ડીપી") રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ ("આરટીએ") સાથે નોંધાવેલ છે. કંપની કાયદા, ૨૦૧૩ ની લોગુ જોગવાઈઓ અનુસાર અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફર્સ દ્વારા બહાર પાડવામ આવેલ જનરલ સરક્યુકલ નં.૧૪/૨૦૨૦, તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, નં.૧૭/૨૦૨૦, તારીખ વ3મી એપ્રિલ, ૨૦૨૦, નં.૨૦/૨૦૨૦, તારીખ ૫મી મે, ૨૦૨૦, નં.૦૨/૨૦૨૧, તારીખ ૧૩મી બન્યુઆરી, ૨૦૨૧ અને નં.૧૦/૨૦૨૨, તારીખ ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨ અને સેબી સરક્યુલર ri. SEBI/HO/CF0D/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨મી મે, ૨૦૨૦, SEBI/H0/CFD/CMD2/CIR/P/2021/11 તારીખ ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ વરમી મેં, ૨૦૨૨ અને SEBI/H0/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ ૫મી જાન્યુઆરી, ૨૦૨૩ સાથે વાચતા અને અનુસરતા આ નોટીસ આપવામાં આવે છે.

કંપની એ વીસી / ઓએવીએમ દ્વારા એજીએમમાં ભાગ લેવા, ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા એજીએમમાં મત આપવાનો અધિકાર અને એજીએમ પૂર્વે રિમોટ ઈ-વોટીંગ માટેની વ્યવસ્થા કરી છે. વીસી / ઓએવીએમ દ્વારા એજીએમમાં જોડાવવા માટેની સૂચનાઓ અને ઈ-વોટીંગની પ્રક્રિયામાં ભાગ લેવાની રીત નોટીસ અને વાર્ષિક અહેવાલ સાથે પૂરી પાડવામાં આવશે .

કંપની/આરટીએ/ડીપી સાથે બેંક વિગતો/ઇમેઇલ આઇડી નોંધણી કરાવવાની પ્રક્રિયા

જે સભ્યોએ કંપની / આરટીએ / ડીપી સાથે ઈ-મેઈલ આઈડી / બેંક વિગતો નોંધાવી અથવ અપડેટ કરી નથી , તેમને ઇ-કોમ્યુનિકેશન / ડિવીડન્ડ મેળવવા માટે કંપની / આરટીએ / ડીપી સાથે તેમની ઇ-મેઇલ આઇડી / બેંક વિગતો નોંધાવવા / અપડેટ કરવા વિનતી છે. બેંક વિગતો નોંધાવવાથી કંપની જ્યારે ડિવીડન્ડ જાહેર કરે ત્યારે સીધા તેમનાં બેંક ખાતામાં ઈલેક્ટોનિક ોડ દ્વારા જમા થઈ શકે. આ માટે સભ્યોએ નીચે જણાવેલ પગલાઓને અનુસરવા વિનંતી છે. ફિઝીક્લ શેર (પેપર સ્વરૂપે) ધરાવતા સભ્યોઃ

સભ્યોને વિનંતી છે કે નામ, ફોલિયો નંબર, મોબાઈલ નંબર, શેર પ્રમાણપત્ર (બંને બાજુ) ની સ્કેન કરેલી નક્લો, સ્વ-પ્રમાણિત આઈડી પુકૃ, સરનામાનો પુરાવો અને ઈ-મેલ આઈડી / કેન્સલ ચેક ઈ-મેલ દ્વારા ahmedabad@linkintime.co.in અથવા info@sgligis.com પર મોકલવા વિનંતી કરવામાં આવે છે.

ડિમેટ મોડમાં ઈક્વિટી શેર ધરાવતા સભ્યો: ાભ્યોને તેમના ડીપી દ્વારા તેમની ઈ-મેઈલ આઈડી / બેંક વિગતો નોંધાવવા / અપડેટ કરવા

બુક ક્લોઝર <u>ની નોટીસ</u>

કંપની કાયદા ૨૦૧૩ ની ક્લમ ૯૧ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝ રીકવાચરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિચમ ૪૨ મુજળ કંપનીએ એજીએમના હેતુ માટે ળુક ક્લોઝરની તારીખ શનિવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૩ થી શુક્રવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૩ (બેન્ટ દિવસ સહીत) नड्डी કરેલી છે .

<mark>આ જાણકારી અને આના અંગેની વધુ જાણકારી કંપનીની વેબસાઈટ</mark> www.sgligis.com અને સ્ટોક એક્ટોન્જની વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ રહેશે .

તારીખઃ સપ્ટેમ્બર ૪, ૨૦૨૩ સ્થળઃ અમદાવાદ

સ્કેનપોઈન્ટ જીઓમેટિક્સ લિમિટેડ વતી કાંતિલાલ વ્રજલાલ લદાની

હોલ ટાઈમ ડાચરેક્ટર (DIN: 00016171)

બોદાલ કેમિકલ્સ લિમિટેડ સੀਆਈએન : L24110GJ1986PLC009003

રજીસ્ટર્ડ ઓફ્સિ : પ્લોટ નં. ૧૨૩–૧૨૪, ફ્રેઝ–૧, જી.આઈ.ડી.સી, વટવા, અમદાવાદ

કોર્પોરેટ ઓફિંસ : "બોદાલ કોર્પોરેટ હાઉસ", આર્નેદ નિકેતન સ્કૂલ પાસે, શિલજ સર્કલ નજીક, એસ.પી. રીગ રોડ, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૯. Ph.: 079-68160100 • E-mail: secretarial@bodal.com • Web: www.bodal.com

૩૯મી વાર્ષિક સામાન્ય સભા (AGM), ઈ-વોટીંગ અને બુક્લંઘ અંગે નોટિસ

ઝાથી સભ્યો ને નોટિસ આપવામાં આવે છે કે કંપનીની ૩૭મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ ગુરૂવારે, તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩, ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે વીડીયો કોન્ફરન્સ (વીસી) / અન ઓડિઓ વીડીયો માધ્યમ (ઑએવીએમ) દ્વારા યોજાશે, જેમાં એજીએમ નોટિસ માં દર્શાવ્યા મુજબનું કા કાજ હાથ ધરવામાં આવશે. કોવિડ-૧૯ મહામારી અંતર્ગત, ભારત સરકારે, મિનિસ્ટ્રી ઓફ અફેર્સના, પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તા

૮મી એપ્રિલ ૨૦૨૦, પરિપત્ર નં. ૧૭/૨૦૨૦, તા. ૧૩મી એપ્રિલ ૨૦૨૦ અને પરિપત્ર નં. ૨૦/૨૦૨૦, તા. પમી મે ૨૦૨૦ના રોજ તથા સિક્યોરિટીઝ એક્સરોન્જ બોર્ડ ઓક ઈન્ડિયા (સેબી)ના પરિપત્ર નં SEBI/H0/CFD/CMD1/CIR/2020/79, તા. ૧૨મી મે ૨૦૨૦ ("પરિપત્રો") દ્વારા એજીમ કોઇપણ વ્યક્તિની પ્રત્યક્ષ હાજરી વિના માત્ર વીસી/ઓએવીએમ દ્વારા ચોજવાની પરવાનગી આપેલ છે. અ પરિપત્રોના અંતર્ગત અને કંપનીઓના કાયદા, ૨૦૧૩ની સંબંધિત જોગવાઈઓ અને સેબે (લીસ્ટીંગ એબ્લીગેશન અને ડીસક્લોઝર રીકવાયરમેન્ટસ) નિયમો, ૨૦૧૫ના પાલનમાં, કંપનીના 🥫 એજાએમ વીસી/ ઓએવીએમ ત્વારા લેવામાં આવશે. ઉપરોક્ત પરિપ્ર્યો ના અનુસંધાનમાં, વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ સાથે એજીએમની નોટિસ ફક્ત તે જ

સભ્યોને ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોક્લવામાં આવી રહી છે, જેમના ઈ–મેઈલ આઈડી કંપની/ ડિપોઝિટરી સમક્ષ નોંધાયેલા છે. સભ્યોએ નોંધ લેવી કે એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ કંપનીની વેબસાઈટ: www.bodal.com, સ્ટોક એક્સચેંજની વેબસાઈટો – બીએસઈ લિમિટેડ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડ: www.nseindia.com પર ઉપલબ્ધ રહેશે, તથા રિમોટ ઈ-વોટિંગની સુવિધા પૂરી પાડનાર સંસ્થા સીડીએસએલ ની વેબસાઇટ: www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યો એંજીમમાં ફક્ત વીસી/ઓએવીએમ સુવિધા દ્વારા જ હાજર રહી શકે છે અને ભાગ લઈ શકે છે. એજીએમમાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની નોટિસમ આપવામાં આવેલ છે અને કંપનીઓના કાયદા, ૨૦૧૩ ની ક્લમ ૧૦૩ અન્વયે, વીસી / ઓએવીએમ દ્વાર જોડાયેલ સભ્યોને, હાજર રહેલ સભ્યોની ગણતરીના હેતુ માટે માન્ય રહશે.

3૭મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ જે શેરહોલ્ડર કટ-ઓફ તારીખે શેર ધરાવતા હશે એમને શેરહોલ્ડરના રજિસ્ટર્ડ ઇ–મેઇલ આઇડી પર મોક્લી આપવામાં આવશે, જે કાયદાની જોગવાઇઅ કંપનીઓના કાયદા ૨૦૧૩ની કલમ–૯૧ અને સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન અને ડીસકલોઝર

રીકવાયરમેન્ટસ) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૪૨ અનુસાર, શનિવાર ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૩ થી ગુરવાર ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ (બંને દિવસો સહિત), સંભવિત વાર્ષિક ડિવિડન્ડ તથા ૩૭મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજવાના હેતુથી કંપનીના સભ્યોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક બંધ રાખવા

સેબી (એલઓડીઆર) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૪ મુજબ તથા કલમ ૧૦૮ ઓફ કંપનીન કાયદા. ૨૦૧૩ અને કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટેશન) નિયમો. ૨૦૧૪ ના નિયમ ૨૦ ર્ન જોગવાઈઓને અનુસાર, સભ્યોને ઈ-વોટિંગની સુવિધા સી.ડી.એસ.એલ. મારફતે પ્રદાન કરવામ ઝાવેલ છે, જે દ્વારા એજીમની નોટિસમાં દર્શાવેલ ઠરાવો પર તમારો મત આપી શકાય છે. કંપની દ્વારા એજાએમ ("ઈ–વોટિંગ") દરમિયાન ઈ–વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવાની સુવિધા પ્રદાન કરેલ છે. સભ્યોના મતદાન અધિકારો તેમના ઈક્વિટી શેરના હોલ્ડિંગ સોમવાર, ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૩ (કટ-ઓફ ડેટ) પ્રમાણે રહેશે.

નોટિસ મોકલ્યા તારીખ : ૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ ઈ-વોટિંગની ક્ટઓફ તારીખ : ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૩ રિમોટ ઈ-વોટિંગ સોમવાર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ને સવારે ૯:૦૦ વાગ્ચે શરૂ થશે અને બુધવાર, ૨७ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે.

ગાળા દરમિયાન, સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકે છે અને ત્યારબ સી.ડી.એસ.એલ. દ્વારા ઈ-મતદાન મોડ્યુલ બંધ કરી દેવામાં આવશે. તે સભ્યો, જેઓ વીસી/ ઓએવીએમ સવિધા દ્વારા એજાએમમાં હાજર રહેશે અને રિમોટ ઈ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાન મત આપ્યો ન હોય તો તેમને આમ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે નહીં, તે એજીએમ દરમિયાન ઈ–વોટિંગ સિસ્ટમ દ્વારા મત આપવા માટે પાત્ર બનશે. જે સભ્યોએ એજીએમ પહેલા રિમોટ ઈ–વોટિંગ દ્વારા મત આપ્યો છે તે વીસી/ઓએવીએમ દ્વારા પણ એજીએમમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેઓ ફરીથી મત આપવા માટે હકદાર રહેશે નહીં.

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો ધરાવે છે અને એજીએમ નોટિસ કંપની દ્વારા ઈલેક્ટ્રોનિકલી મોકલય પછી તે કંપનીનો સભ્ય બને છે, અને કટ-ઓફ તારીખે શેર ધરાવે છે તે ઈમેલ આઇડી helpdesk.evotingindia.com પર વિનંતી મોકલીને લૉગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે જો તે પહેલાથી જ રિમોટ ઈ-વોટીંગ માટે સી.ડી.એસ. એલ. સાથે નોંધાયેલ છે, તો તે મતદાન કરવા માટે તે/તેણીના હાલના યઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.

. શેરહોલ્ડરો, ઈ-વોટિંગને લગતી તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો, શેરધારકો સહાય વિભાગ હેઠળ www.evotingindia.com પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને ઈ–વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈ–મેઇલ લખી શકે છે. કંપનીએ સ્કૂટીનાઈઝ પ્રોસેસ માટે શ્રી તપન શાહ (મેમ્બરશીપ નં. FCS 4476; CP No: 2839)ની નિમણ્રંક

કરી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરના હુકમથી તારીખ : ૦૪-૦૯-૨૦૨૩ બોદાલ કેમીકલ્સ લીમીટેંડ વતી આશુતોષ બી. ભટ્ટ (કંપની સેક્રેટરી) સ્થળ : અમદાવાદ

HCP PLASTENE BULKPACK LIMITED (Formerly Known as Gopala Polyplast Limited)

CIN: L25200GJ1984PLC050560

Registered Offiice: H.B. Jirawala House, Navbharat Soc, Nr. Panchshil Bus Stand, Usmanpura, Ahmedabad, Gujarat-380013. • Tel.: +91-79-27561000 • Email: cs@hpbl.in • Website: https://hpbl.in

INFORMATION REGARDING 39TH ANNUAL GENERAL MEETING (AGM) TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") / OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that 39th Annual General Meeting ("AGM") of HCP PLASTNE BULKPACK Limited ('the Company" will be held through video conferencing (VC)/ other audio visual means (OAVM) on Friday, 29th September, 2023 at 11:30 A.M. (IST) without physical presence of the members at the venue in compliance with applicable provisions of the Companies Act, 2013 read with General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 20/2020 dated 5th May, 2020, General Circular No. 02/2021 dated 13th January, 2021, General Circular No. 21/2021 dated 14th December, 2021 and General Circular No. 02/2022 dated 5th May, 2022 and General Circular No. 10/2022 dated 28" December, 2022, respectively, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15" January, 2021, Circular No. SEBI/HO/DDHS/P/CIR/2022/0063 dated 13th May, 2022 and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/CIR/2023/4 dated 5th January, 2023 respectively, issued by the Securities and Exchange Board of India, to transact the business as set out in Notice convening the 39th AGM.

Electronic copy of the Notice convening the 39" AGM, containing among others, procedure & instructions for e-voting and the Integrated Annual Report for the FY 2022-23 will be sent, in due course, to those members whose e-mail ID is registered with the Company/Depository Participant.

The Members can attend and participate in the AGM through VC/OAVM only. Detailed instructions for joining the AGM will be provided in the Notice of AGM. Members attending the meeting through VC / OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

Members who have not registered their e-mail address, are requested to register the same at the earliest.

In respect of shares held in demat form-with their depository participants (DPs) In respect of shares held in physical form- (i) by writing to the Company's Registrar and Share Transfer Agent viz. Big Share

Services Private Limited, with details of Folio number, and self-attested copy of PAN card by sending email to bssahd@bigshareonline.com Members holding shares in demat form can also send e-mail to aforesaid e-mail ID to register their e-mail address for the

mited purpose of receiving the Notice of 39th AGM and Integrated Annual Report for the FY 2022-23. Members who have not updated their bank account details for receiving the dividends directly in their bank accounts nrough Electronic Clearing Service or any other means may follow the below instructions: Demat Holding Members holding shares in demat form are requested to update their bank account details with

In case the Company is unable to pay the dividend to any Member(s) in their bank accounts through electronic or any other means, due to non-registration of bank account details by the Member(s), the Company shall dispatch the dividend warrant / cheque to such Members at the earliest, on normalisation of postal services and other activities.

The Company will provide facility to Members to exercise their rights to vote by electronic means. The instructions for oining the 39^{th} AGM through VC/OAVM and the process of e-voting (including the manner in which members holding shares in ohysical form or who have not registered their e-mail address can cast their vote through e-voting), will form part of the Notice

Notice convening the 39th AGM and the Integrated Annual Report for the FY 2022-23 will also be available on the website of the Company at www.hpbl.in and of the stock exchanges viz. BSE at www.bseindia.com in due course

For, HCP Plastene Bulkpack Limited

Managing Director

Prakash Parekh